

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન સીટીની સગવડો સુરક્ષિતપણે પુનઃખોલવાની (રિઓપનીંગ) અને સેવાઓ ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 26, 2020) – સપ્ટેમ્બર 9 થી શરૂ કરીને, સીટી હોલ સહિતની સીટીની કોર્પોરેટ સગવડો જાહેર જનતા માટે રૂબરૂમાં સેવાઓ માત્ર એપોઈન્ટમેન્ટથી ફરીથી ખોલવામાં આવશે. પ્રવર્તમાન આરોગ્ય અને સુરક્ષા ઉપાયોને ટેકો આપવામાં મદદ માટે બધી સગવડોમાં વોક-ઇન્સ (એપોઈન્ટમેન્ટ વગર ગમે ત્યારે ચાલ્યા આવવાનું) બંધ રહેશે.

સપ્ટેમ્બર 16 થી શરૂ કરીને, કાઉન્સિલની ચેમ્બર્સ જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવશે જેમાં મહત્તમ 50 લોકો રૂબરૂમાં માત્ર પહેલેથી બુકિંગ કરાવીને મીટિંગ્સમાં હાજર રહી શકશે. કમિટી અને સીટી કાઉન્સિલની બધી મીટિંગ્સમાં જોડાવા, રજૂઆત કરવા અને પ્રતિનિધિ મોકલવા માટે સીટી ઓનલાઇન વિકલ્પો પૂરા પાડવાનું ચાલુ રાખશે.

રૂબરૂમાં સેવાઓ અને એપોઈન્ટમેન્ટ બુકિંગ પ્રક્રિયાની વિગતો આગામી દિવસોમાં સીટીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. મુલાકાત લો ત્યારે શું અપેક્ષા રાખવી અને જાહેર જનતાને સુરક્ષિત રાખવા સીટી પોતાનો ભાગ કેવી રીતે ભજવે છે તેને લગતી વધુ વિગતો માટે વેબસાઇટ જુઓ, brampton.ca/reopening.

મનોરંજન કેન્દ્રો (રિક્રિએશન સેન્ટર્સ)

પસંદગીની સીટી ઓફ બ્રેમ્પટન મનોરંજન સગવડો માત્ર આરક્ષિત એપોઈન્ટમેન્ટ્સ માટે ફરીથી ખોલવામાં આવશે. ઈનડોર પૂલ્સ, ફિટનેસ સગવડો, અને સીમિત સામાન્ય કાર્યક્રમો લેબર 3 (સપ્ટેમ્બર 7) પછી આરક્ષણ (રિઝર્વેશન) કરાવીને ફરીથી શરૂ થશે. લેબર 3 પછી શરૂ થતા બધાં કાર્યક્રમો અને સેવાઓ અંગે માહિતી માટે, જગ્યા કેવી રીતે આરક્ષિત કરાવવી તે સહિત, આ વેબસાઇટ www.brampton.ca/recreation પર સપ્ટેમ્બર 1 નાં રોજ ઉપલબ્ધ થશે.

અવતરણો (ક્વોટ્સ):

“આપણાં સમુદાયે આપણને આ તબક્કા સુધી પહોંચાડવા મદદ કરવામાં તેઓના પ્રયત્નો માટે તેઓનો આભાર. અમે સેવાઓને રૂબરૂમાં સાવચેતી રાખીને તબક્કાવાર પુનઃખોલવા અને પુનઃરજૂઆત પર ધ્યાન આપીને અમારા જાહેર આરોગ્ય નિષ્ણાતોની સલાહ અનુસરવાનું ચાલુ રાખ્યું છે. આ આપણાં સૌ માટે નવી વાસ્તવિકતા છે ત્યારે, અમે આને સુરક્ષિત અને ખામીરહિત તબદીલી દરેક વ્યક્તિ માટે બનાવવા કાર્યરત છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“અમારા રિઓપનીંગ સર્વે મારફતે, અમે સાંભળ્યું કે 70% જેટલા રહેવાસીઓ ઈચ્છતા હતા કે સીટી શક્ય એટલી ઓનલાઇન સેવાઓ પૂરી પાડે. બિલ્ડિંગ પરમીટ્સ, ઈવેન્ટ્સથી માંડીને જાહેર સલાહ-મસલત સુધી, અમે આપણાં સમુદાય અને ધંધાઓ માટે વધારે સુરક્ષિત ઓનલાઇન વિકલ્પો પૂરા પાડવાની તૈયારી બતાવી છે. આપણે ધીરે ધીરે રિઓપનીંગ કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે સુરક્ષિત, પહોંચ સુલભ અને અનુકૂળપણે ધંધો કરવાની નવી રીતો શોધવાને અગ્રતા આપવાનું અમે ચાલુ રાખીશું.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), મેયરનું રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“વિતેલા થોડાક મહિનાઓથી, કર્મચારીઓ આપણી સગવડોને સુરક્ષિત રિઓપનીંગ માટે તૈયાર કરી રહ્યાં છે. અમે શારીરિક અંતર જાળવવાના ઉપાયો, વધારે સારી સફાઈ પ્રક્રિયાઓ, બધાં કર્મચારીઓ માટે દરરોજ સક્રિય સ્કીનિંગ, આ બધું શરૂ કર્યું છે અને રિમોટ વર્ક એક્સેસને પ્રોત્સાહન આપ્યું છે. આ બધાં પ્રયત્નો ખાતરી કરાવે છે કે અમારા દ્વારા આપણાં સમુદાયને પૂરી પડાતી સેવા સાથે બાંધછોડ કર્યા વગર આપણે જાહેર આરોગ્ય માર્ગરખાઓને વળગી રહીએ છીએ.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

મિડિયા સંપર્ક

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca